



TAYLORMADE
RENEWABLES LTD.

Energy | Environment | Innovation

To,
BSE LTD.,
FLOOR 25, P. J. TOWERS
DALAL STREET,
MUMBAI - 400001

SUB.: NEWS PAPER ADVERTISEMENT FOR THE NOTICE OF 13TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY

Dear Sir,

We enclose copy of each newspaper clipping of the advertisement published on 06/09/2022, in terms of ministry of corporate affairs Circulars No. 20/2020 dated 5th May 2020, inter alia intimating that the 13th Annual General meeting of the company will be held on Friday 29th September 2023 at 11.00 A.M at 705, "SHAPATH-II", OPP. Rajpath Club. S.G. Road, Bodakdev, Ahmedabad – 380054

Kindly take the above information on your record.

Thanking You,

Yours faithfully,

For, TAYLORMADE RENEWABLES LIMITED

GOR DHARMENDRA SHARAD
DIN- 00466349
MANAGING DIRECTOR

CIN No.: L29307GJ2010PLC061759

Data's Oil Data's King Kong



the biggest gift to the Information Technology (IT) sector has been received in the form of the Digital Personal Data Protection (DPDP) Bill. When India is covering the world in the IT sector and global companies are setting up their units in India, the need for data protection arose. After the bill was passed in the Rajya

Sabha last Wednesday, it will be sent to the President for assent and will become a law.

Ever since the Data Protection Bill was passed in Parliament, big and reputed companies like Meta, Alphabet have been reeling as they will now face direct controls. Ever since the discussion of data bill started,

Reliance's Mukesh Ambani said that data is oil. That is, as much as oil is important in the economic system, so is the importance of data protection bill.

Let's not forget the fact that politicians were not as

interested in the Data Protection Bill as they were in the debate on the motion of no confidence against the government. The bill provides for curbing the arbitrariness of foreign companies operating social media and also provides for imposing a huge fine of up to 250 crore on violators of the law. People and the government have repeatedly felt that social media companies were arbitrary and in some cases ignored the notices issued by the government. Under the new law, the government will be able to hold their ears and enforce the law. Exactly one year ago, the government withdrew the Data Protection Bill 2019 (DPB 2019). Subsequently, the Digital Personal Data Protection Bill known as DPDPB 2023 was drafted to increase the power of users. The government said in the parliament why we withdrew the bill of 2019 and what amendments have been made in the bill of 2023.

During the debate on the bill in the Lok Sabha, the

issue of human rights was raised. Union Minister Rajiv Chandrasekhar said that when there is a problem of national security, everyone's data can be checked even on social networks like YouTube. There is a controversy over the fact that the Data Protection Bill has not been linked to RTI. The bill also mentions that personal details on the data bank cannot be sought through RTI.

Internet freedom activists are upset with the data protection bill as they feel it is used to arbitrary internet and does not like any government restrictions. The provision to impose a penalty of Rs 250 crore on a company that does not respect personal data or tampers with it is also being welcomed. There is also a provision to impose a fine of Rs 50 crore on a company that fails to protect data. There is also a provision to impose a fine of 10,000 rupees on giving wrong information while submitting any document.

At first glance, the bill is meant to crack down on data

breaches. Union IT minister Ashwini Vaishnaw said that after a long discussion it will be given the green light by both houses of Parliament. Under this bill, the rights of users of digital systems to their own data will be increased and the control of data by international companies will be reduced. The government will create a Data Protection Board and will be empowered to protect people's data.

By passing the Data Protection Bill, the government has put the world's giant social network companies in a fix. Because the Government of India will be able to stop their arbitrariness and the details that the Government will ask for are bound to be provided immediately.

Some companies have been collecting data of citizens not only from India but from all over the world. A company formerly known as Twitter, X(t) recently wanted to build a business model in India using data.

Now that the Data Protection Bill is about to come into effect, no

personal data can use people's personal data.

India's data protection bill will be a challenge for US technology companies as they have millions of users in India. The government had put some restrictions on e-commerce to take strict action against sellers of objectionable goods.

The officials of India have explained to the government that as the American giant companies are operating in compliance with the law in China, the same should be done in India. American companies are investing and doing business in South Asia on a large scale. People are also getting addicted to shopping on e-commerce.

businessman John Scully has said that no effective marketing is possible without accurate customer data. American business professional Marissa Mayer has said that data should be collected as early as possible because whoever has the data can win. Douglas Merrill, CEO of America's Zeist Finance, has said that collecting data is not a trivial matter, it requires talent. American computer programmer Daniel Moran has said that you can collect data without information but you cannot collect information without data. American statistician Edward Tufel has said that everything else is fine, it is important to show the data first.

CEO of a data solution company in New Jersey and known as the data doctor in America, said that where there is smoke in data, there is business fire. The opinions of those explaining the significance of the data are given above. They all say data is king. India has shown its importance by bringing the data bill on time.

These marketing mistakes can ruin a company

Philip Kotler is considered the father of modern marketing and according to him ten types of mistakes are fatal for companies in the field of marketing of goods or services (banking, finance, IT, tourism, consultancy, insurance, transportation, medical, education etc.). Above is a long list of services because the contribution of services to GDP in the modern economy continues to increase and so far the field of management education has given more attention to

manufacturing industries and marketing of goods. Services has been almost ignored. Mistakes that companies make in marketing products or services Prof. Kotler has identified i.e. identified. Every company head should see to it that his company does not make one or more mistakes.

Following is the list of these errors. (1) The company or firm or organization or business is not sufficiently market centric and customer centric. This is an obvious

point that many companies do not understand because most of the companies are production centric and try hard to reduce production costs and believe that if the customers do not buy our products, where will they go? They have no choice but to buy our products. If you have a monopoly (absolute power) in the products or service sector, the above may be true, but in this era of intense competition, the superior attitude of the company can prove fatal for it.

Another fatal mistake in the marketing field is that the company does not have full knowledge or understanding about its target consumers. Tata nano car will be accepted by the general public and people will upgrade from scooters and buy nano cars. It is very difficult to know in advance which product or improvement customers will like. Even marketing experts are confused about this. Market research can be useful but its findings are not always accurate.

(3) If the company is oblivious to its competitors, does not want to know their performance and does not niche the strategy of rivals, the rival firms defeat or remove such unconcerned firms. Successful companies must constantly be aware of their competitors' identities and strategies and monitor for this in English is especially worth remembering. (4) Companies should not only care about shareholders. Instead of the concept of shareholders, the concept of stakeholders has become more important for companies or other organizations. In addition to shareholders, a company's stakeholders include its employees, customers, suppliers, distributors, local and state governments, the company's neighbors (whom some companies harass by emitting fumes, polluting water or air, or making loud noises), etc. A company that cannot maintain a balance between the interests of all stakeholders. Its reputation is threatened and its market shrinks. If a company has an image of honesty and fairness, customers will respect it.

Marketing of past achievements can build self-esteem in people but it also stifles people's logical and conceptual thinking. (6) The company's marketing plans and market planning process are too slow or faulty. Market planning is the heart of the marketing department which ceases to exist if it stops. Market planning is a continuous process like the heart. (7) Company product service policy is weak. When you save money and buy a car and the car breaks down and the company doesn't notice it and does nothing about it, the reputation of companies without customer service sinks. Yet some retailers behave in a totally irreparable manner in this area.

(8) Every company now lays special emphasis on its brand image and spends heavily to enhance its brand image. In management this is called brand building. Everyone knows that political parties now spend crores of rupees to enhance their party's brand image. (9) Management of marketing department of the company is weak e.g. Marketing director or his subordinates lack marketing skills. So it has a bad effect in the company. (10) The company has not made maximum use of technology. E.g. The marketing department of the company does not have any website. No internet services at all, etc. Such mistakes Companies that persist are doomed.

TAYLORMADE RENEWABLES LIMITED
 CIN- L29307GJ2010PLC061759
 E-Mail - cs@tss-india.com, Contact-079-40040888

NOTICE TO THE SHAREHOLDERS 13th ANNUAL GENERAL MEETING

NOTICE IS HEREBY GIVEN THAT THE 13th ANNUAL GENERAL MEETING (AGM) of the members of the Company will be held on Friday, 29th September, 2023, at 11:00 AM in the PVR, Rajawade Club, S.G. Road, Bodakdev, Ahmedabad - 380054 to transact the business as set out in the notice of AGM, which is being circulated for convening the AGM. Notice of the AGM along with Annual Report 2022-23 is being sent out by Electronic mode to those members whose Email addresses are registered with the company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report of 2022-23 will also be available on Company's website: www.tssindia.com and website of the stock exchange i.e. BSE Limited at www.bseindia.com and AGM Notice is also available on website of CDSL (agency for providing remote e-voting facility i.e. www.evotingindia.com).

The Company is providing remote e-voting facility (remote e-voting) to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Detailed procedure for remote e-voting is provided in the Notice of AGM. In case members have not registered their email addresses with the company/Depository, please follow the below instructions to register email address for obtaining Annual Report and login details for e-voting.

a. For members holding shares in physical mode: Please provide necessary details like Folio No., Name of shareholder by email to cs@tss-india.com.

b. Members holding shares in demat mode can get their email ID registered by contacting their respective depository participant or by email to cs@tss-india.com.

The 13th AGM Notice will be sent to the shareholders holding shares as on cut-off date for the dispatch in accordance with the applicable laws on their registered email addresses in due course.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com.

BY ORDER OF THE BOARD
FOR, TAYLORMADE RENEWABLES LIMITED
 Dharmendra Shahad Patil
 Managing Director

Date: 06.09.2023
 Place: Ahmedabad

India's success is case study in using technology to transform citizens' lives: Mos Rajeev Chandrasekhar

Union Minister of State for Skill Development & Entrepreneurship and Electronics & IT Shri Rajeev Chandrasekhar addressed the World Bank Digital Economy Conclave 2023, where he highlighted India's success as a case study in using technology to transform citizens' lives. He emphasized the milestones achieved through Digital India in the past nine years, which catalysed the country's rapid progress towards a five trillion US dollar economy by 2026. The Minister said, "In 2015, through the launch of Digital India, Prime Minister Shri Narendra Modi set unconventional expectations through three broad goals - technology should improve the lives of citizens."

Around the Market - mandate to expedite Make in India schemes

After the Directorate General of Foreign Trade postponed the implementation of import controls on laptops, personal computers and related items till November 1, companies importing such products have been quick to announce their plans to manufacture in India. In a meeting of electronic companies with the government, some companies sought an extension of more than

three months to complete license requirements and set up manufacturing bases in India. Some urged the government not to impose any quotas on imports after companies get licenses. The also sought clarification on the validity of the licence.

Finance Minister Nirmla Sitharaman held a meeting with chairpersons of regional rural banks in the southern region to discuss

strategies for reform. One of the key points made by Sitharaman was to promote digital banking to regional rural banks. Apart from this, it was discussed to improve the current and savings account ratio of these banks and focus on increasing their financial stability and increase their ability to extend credit to various sectors. He suggested regional rural banks to embrace more digital banking and focus on increasing the number of digitally active customers. Which is aligned with the government's broader effort to move towards a more digital economy. He said adoption of technology, loan management and core banking system should be prioritized in a time bound manner. E-commerce company Flipkart founder Sachin Bansal has made bumper profits from his company Chaitanya India Pvt. Sachin has earned Rs 150 crore to Rs 1450 crore in just four years. Sachin Bansal-invested company Chaitanya India Fintech Pvt Ltd is going to buy independent Microfin Pvt Ltd. Swatantra Microfin Pvt Ltd is owned by Anyana Birla, daughter of veteran industrialist Kumararamangalam Birla. Anyana Birla is preparing to play a big bet in the financial sector. According to media reports, the deal could be done for Rs 1,479 crore and is expected to be completed by the end of this year. After this acquisition, Swatantra Microfin could become the largest micro finance company in India.

MEHTA HOUSING FINANCE LIMITED
 CIN: L19202GJ200223OF0001
 Registered Office: Plot No. 1A Revenue Survey No. 203, Savarkunda Road, Taverla, Mahasana, Bhavnagar, Gujarat-364500
 website: www.mehtahousing.com; Email: info@mehtahousing.com

NOTICE OF 29th ANNUAL GENERAL MEETING

E-VOTING INFORMATION AND BOOK CLOSURE DATES

NOTICE is hereby given that:

- The 29th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, September 29, 2023, at 12:30 noon at 1st Floor, Industrial Plot No. 43, Station Road Mahasana, Gujarat - 364500, to transact the ordinary and special business as set out in the Notice of AGM.
- Pursuant to Section 91 of the Companies Act, 2013 read with rule made thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 and SEBI (Share Transfer Book) Regulations, 2015 (Share Transfer Book) Regulation, the Register of Members of the Company will remain closed on Saturday, September 23, 2023, to Friday, September 26, 2023 (both days inclusive) for the purpose of AGM.
- In compliance with provisions of Section 109 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (including statutory modification(s) and amendments thereon) thereof of the time being in force, Regulation 42 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 and SEBI (Share Transfer Book) Regulations, 2015 and SEBI (Share Transfer Book) Regulation, 2015 and SEBI (Share Transfer Book) Regulation, 2015, the Company is pleased to provide to all its members, the facility to exercise their right to vote by electronic mode on all the resolutions and the business may be transacted through remote e-voting service provided by NSDL. Members of the Company holding shares either in physical form or dematerialized form, as on the cut-off date, may cast their vote electronically from a place other than venue of the AGM (remote e-voting), on the business as set out in the Notice of AGM. All members may please note the following:

Final date	September 29, 2023 (Friday)
Commencement of Remote e-voting	September 25, 2023, at 09:00 a.m. (Thursday)
End of Remote e-voting	September 28, 2023, at 05:00 p.m. (Monday)

The e-voting module shall be disabled by NSDL for voting thereafter and no remote e-voting shall be allowed thereafter.

- The facility for voting, through ballotpaper shall also be made available at the venue of the AGM. The Members attending the Meeting are to cast their vote through remote e-voting shall be exercise their voting rights at the Meeting. The Members have already cast their vote by remote e-voting may attend and participate in the AGM but shall not be entitled to vote in the Meeting.
- In compliance with the provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 the Company has appointed Mrs Pinky Shethia and Associates, Practising Company Secretary, a scrutinizer for conducting the e-voting and polling process at the AGM in a fair and transparent manner.
- Any person who acquires shares of the Company and becomes member of the company after the dispatch of Notice of the AGM and holds shares as on the cut-off date i.e. September 22, 2023 may obtain the user ID and Password by sending request at evoting@nsdl.com. However, if a person is already registered with NSDL for e-voting, then the existing user ID and Password can be used for casting vote.
- To support the Green Initiative, Members who have not registered their email addresses are requested to register the same with the Company's RTA or physical record documents at their Depository Participants, in respect of shares held in physical/electronic mode, respectively. RTA: M/s. Purna Shreevastra (India) Private Limited, A-6/1, Shri. Shakti Industrial Estate - I/B, Boricha, Wagle, Lower Panel (East), Mumbai - 400 011. Email: siddhant@purna.co.in

For detailed instructions pertaining to e-voting, members may please refer Notice of AGM or AGM or may refer to the frequently asked question (FAQ) and e-voting user manual of the help section of NSDL at <https://www.evotingindia.com> or contact NSDL at the following toll-free no: 1800 1030 1800 / 1800 224 430 or Mr. Haridkumar Tarkar, NSDL at haridkumar@nsdl.com or evoting@nsdl.com.

For Mehta Housing Finance Limited Sd/-
 Kinjal Kothari
 Company Secretary & Compliance Officer

Date: 05.09.2023
 Place: Mumbai
 MR-56987

PHYSICAL POSSESSION NOTICE

ICI Home Finance
 Registered Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai-400051

Branch Office: ICICI HFC Tower, JB Nagar, Andheri Kurla Road, Andheri East, Mumbai-400059
 Branch Office: 1st floor, Shakti Business Centre, Above United Bank, Mehansga Highway, Mehansga-384002 Whereas

The undersigned being the Authorized Officer of ICICI Home Finance Company Limited under the Securitisation, Reconstruction and Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and the exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued in compliance with the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Home Finance Company Limited.

Sr. No.	Name of the Borrower/ Co-borrower/ Loan Account Number	Description of property/ Date of Possession	Date of Demand/ Notice (Rs.)	Name of Branch
1.	Bhagabhai Umabhai Mali (Borrower), Vinaben Bhagabhai Mali (Co-Borrower), LHMEH0001137627.	Plot No.57 Sudarshan Residency Dhanera-385310 (Ref. LAN No. LHMEH0001377648). Bounded By: East: Common Plot, West Road, North: Plot No.56, South: Plot No.58. Date of Possession- 03-Sep-23.	10-04-2023 Rs. 1,46,932/-	Mehasana- B
2.	Bhagabhai Umabhai Mali (Borrower), Vinaben Bhagabhai Mali (Co-Borrower), LHMEH00011377649.	Plot No. 57 Sudarshan Residency Dhanera-385310 (Ref. LAN No. LHMEH0001377648). Bounded By: East: Common Plot, West Road, North: Plot No.56, South: Plot No.58. Date of Possession- 03-Sep-23.	10-04-2023 Rs. 31,12,554/-	Mehasana- B

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: September 06, 2023
 Place: Dhamera
 Authorized Officer
 ICICI Home Finance Company Limited

AMARNATH SECURITIES LIMITED
 CIN: LT1202GJ1994PLC023224

Registered Office: 114, SARTHAK, OPP. C. T. CENTRE, BAI, SWASTIK CROSS ROAD, C. ROAD, N/A AHMEDABAD GUJ 380009
 Corporate Office: Office No. FC 20 2nd Floor, Etemia, LBS Marg Near Teen Hathi Naka, Thane Thane Thane MH 400044

Email: amarnathsecurities@gmail.com ; Website: www.amarnathsecurities.co.in

NOTICE OF THE 29th ANNUAL GENERAL MEETING

This is to inform that the 29th Annual General Meeting (AGM) of Amarnath Securities Limited will be held on Thursday, 29th September, 2023 at 12:30 P.M. through VGC/OAVM in compliance with the applicable provision of the Companies Act, 2013 and Rules framed thereunder read with General Circular No. 229/2022 dated May 05, 2022 issued by the Ministry of Corporate Affairs (MCA) read with Circular No. SEBI/HO/CFD/CMD2/IRP/2022/62 dated May 13, 2022, issued by the Securities Exchange Board of India (SEBI) along with any other applicable Circulars issued by MCA and/or SEBI in this regards, to transact the business set out in the Notice of the AGM without the physical presence of the Member at a Common Venue.

The Notice convening the 29th AGM along with the Annual Report for the Financial Year 2022-23 of the Company is sent electronically to all the member whose email addresses are the registered with company/Registrar & Transfer Agent (Registrar RTA)/Depository Participants (DP). Additionally, the Notice of the 29th Annual General Meeting will also be available on the website of the company at www.amarnathsecurities.co.in the stock exchange, i.e., BSE Limited at www.bseindia.com.

All members holding shares in physical mode are mandatorily required to update their PAN, KYC, email ID, mobile number, bank mandate etc. Accordingly members are requested to furnish/ update their email ID, mobile number, PAN number and other KYC details through ISRI-1; for Nomination as provided in Rules 19 (1) of Companies (Share Capital and Debenture) Rules, 2014 through Form SH-3; otherwise to opt out through ISRI-1 and cancellation of nomination (including change of nominee through Form SH-14 pursuant to SEBI Circular dated November 03, 2021). The forms are also available on the website of the Company www.amarnathsecurities.co.in.

The Company is pleased to provide remote e-voting facility of CDSL below as well as during the 29th Annual General Meeting to all its Member to cast their votes on all Resolution set out in the notice convening the 29th AGM. Detailed procedure for remote e-voting will be provided in the notice.

For AMARNATH SECURITIES LTD., Sd/-
 September 5, 2023
 Place: Mumbai
 Ruchi Gossai
 Company Secretary & Compliance Officer

